

RAN-2101130703040005
M.A. (Sem. III) Examination March - 2026
EC-III : Agricultural Economics - III (New)
Time: 2 Hours]
[Total Marks: 50

સૂચના : / Instructions (1) ઉપરોક્ત દર્શાવેલ વિગતો ઉત્તરવહી પર અવશ્ય લખવી. Fill up strictly the above details on your answer book (2) જમણી બાજુના અંક પ્રશ્નના પૂરા ગુણ દર્શાવે છે. The number on the right side indicates the full marks of the question.	Seat No.: Student's Signature
--	--

- પ્ર.1. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો (10)**
- કૃષિ અર્થશાસ્ત્રમાં મૂળભૂત માંગનો સંબંધ સમજાવો.
 - હબરલર આપેલી કૃષિક્ષેત્રની વેપારની શરતો ટૂંકમાં સમજાવો.
 - કૃષિ વિજ્ઞાન કેન્દ્રની બે મહત્વની અગત્યતા જણાવો.
 - કૃષિ આવકમાં માંગની મૂલ્ય સાપેક્ષતાનું મહત્વ સમજાવો.
 - ગુજરાતની બે પ્રતિકાત્મક કૃષિ વિકાસ યોજનાઓ સમજાવો.
- પ્ર.2. કૃષિ ભાવ અસમતુલા સંદર્ભે કોબ-વેબ સિદ્ધાંતિક બંધારણનું વિશ્લેષણ કરો. (13)**
- અથવા**
- સીમાંત અને નાના ખેડૂતોને આવરી લેતા સામાજિક અને આર્થિક સંકટોનું વિશ્લેષણ કરી, નિવારણ માટે યોગ્ય વ્યૂહરચનાઓ રજૂ કરો.
- પ્ર.3. કોબ-ડગ્લાસ તથા CES ઉત્પાદન વિધેયના સૈધ્ધાંતિક લક્ષણો અને કૃષિ ઉત્પાદનની ઈષ્ટતા માટેના તેના પ્રભાવોને ઉજાગર કરો. (13)**
- અથવા**
- કૃષિ પરિવર્તનમાં રાજ્યના હસ્તક્ષેપની ગાથાનું મૂલ્યાંકન નિતિઓ, સંસ્થાકીય માળખા અને નાણાકીય ઉપાયો દ્વારા કરો.
- પ્ર.4. ટૂંકનોંધ લખો (કોઈપણ બે) (14)**
- કૃષિ બજારમાં સ્થિરતા લાવવા માટે ભાવ નીતિ એક ઉપાયરૂપ
 - ગ્રામીણ શ્રમિકો માટે રાષ્ટ્રીય આયોગની પ્રભાવશાળી ભલામણો
 - કૃષિ અર્થશાસ્ત્રના સંદર્ભમાં ઈનપુટ-આઉટપુટ માળખું
 - વૈશ્વિકીકરણના સંદર્ભમાં ભારતીય કૃષિના પ્રશ્નો અને સંભાવનાઓ

ENGLISH VERSION

- Q.1. Answer the following questions briefly. (10)**
1. Explain the Demand Relation in Agriculture Economics.
 2. Explain briefly the concept of terms of trade in agriculture given by Haberler.
 3. State the two Main Scope of KVK.
 4. State the significance of Demand Elasticity in Agriculture Income.
 5. State the two emblematic agriculture development schemes in Gujarat.
- Q.2. Analyse the Cob-Web theoretical construct with special reference to agriculture price disequilibria. (13)**
- OR**
- Q.2. Provide a comprehensive analysis of the Socio-Economic encountered by marginal and smallholders, along with viable strategies for amelioration. (13)**
- Q.3. Elucidate the structural features of the Cobb-Douglas and CES production functions and their ramifications for agricultural resource optimization. (13)**
- OR**
- Q.3. Evaluate the trajectory of State intervention in agricultural transformation through policies, institution infrastructure and fiscal measures. (13)**
- Q.4. Write short notes. (Any two) (14)**
1. Price policy as a mechanism for stabilization in agriculture market.
 2. Salient recommendations of The National Commission on Rural Labour
 3. Input-Output nexus in agriculture Economics.
 4. Problems and prospects of Indian Agriculture in the context of globalization.
-